

B.Com. Semester - 6 (CBCS) Examination**March/April -2020****ACCOUNTING -6 (ELECTIVE)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-1 અરૂણ ટ્રેડિંગ કંપનીની એક શાખા ભાવનગર ખાતે છે. મુખ્ય ઓફિસ શાખાને પડતર વત્તા 25% લેખે માલ મોકલે છે. શાખાના બધા જ ખર્ચા મુખ્ય ઓફિસથી ચુકવાય છે. સિવાય કે પરચૂરણ ખર્ચ કે જે માટે પેટા રોકડ સિલક રૂ.400 લેખે કાયમ માટે જાળવી રાખવામાં આવે છે તેમાંથી ચુકવાય છે. (20)

	રૂ.
સ્ટોક તા.1-1-2019ના રોજ	10,000
દેવાદારો તા.1-1-2019ના રોજ	6,000
પેટા રોકડ તા.1-1-2019ના રોજ	400
ફર્નિચર તા.1-1-2019ના રોજ	12,000
શાખાને ભરતિયા કિંમતે મોકલેલ માલ	40,000
દેવાદારોએ પરત કરેલ માલ	2,000
ગ્રાહકોને આપેલ વટાવ	200
લખી વાળેલ ધાલખાધ	100
રોકડ વેચાણ	6,000
ઉધાર વેચાણ	30,000
શાખાના ખર્ચા:	
પગાર	2,400
ભાડું (નવ માસ માટે)	1,800
શાખા મેનેજરને ચૂકવેલ પરચૂરણ ખર્ચા	350
શાખા મેનેજરે ખરીદેલ ફર્નિચર (તા.1-10-2019)	6,000
મુખ્ય ઓફિસને ચૂકવેલ રોકડ	32,000
સ્ટોક તા.31-12-2019ના રોજ	6,000
દેવાદારો પાસેથી વસૂલ કરેલ રોકડ	32,000

ફર્નિચર પર 10% ઘસારો માંડી વાળો. તા.31મી ડિસેમ્બર, 2019ના રોજ પૂરા થતા વર્ષ માટે મુખ્ય ઓફિસના ચોપડે ભાવનગર શાખા ખાતું, શાખાનું વેપાર ખાતું અને શાખાનું નફા ખાતું તૈયાર કરો.

અથવા

પ્રશ્ન-1 સુરતના દેવ ટ્રેડર્સની જૂનાગઢમાં એક શાખા છે. મુખ્ય ઓફિસ શાખાને મૂળકિંમતે માલ મોકલે છે. શાખા રોકડ તેમજ ઉધાર વેચાણ કરે છે. અને મળેલી બધીજ રોકડ તે જ દિવસે બેંક ડ્રાફ્ટથી મુખ્ય ઓફિસને મોકલી આપે છે. શાખાના બધા જ ખર્ચા મુખ્ય ઓફિસથી ચુકવાય છે, પરંતુ પરચૂરણ ચુકવણી કરવા માટેની પેટા રોકડ મુખ્ય ઓફિસ શાખાને મોકલી આપે છે. દર મહિનાની શરૂઆતમાં રૂ.6,00 પેટા રોકડ તરીકે મોકલાય છે. મુખ્ય ઓફિસના ચોપડામાંથી તા.31-3-2019ના રોજ પૂરા થતાં વર્ષની જૂનાગઢ શાખાને લગતી નીચે મુજબની વિગતો પ્રાપ્ત થઈ છે.

વિગત	ઉધાર બાકી રૂ.	જમા બાકી રૂ.
માલનો સ્ટોક	30,000	1,20,000
દેવાદારો	1,80,000	2,40,000
પેટા રોકડ	1,800	3,000
ફર્નિચર	?	81,000

અગાઉથી ચૂકવેલ વીમો	1,200	900
ચૂકવવાનો બાકી પગાર	2,100	1,800

શાખાને ખર્ચ માટે મોકલેલ રોકડ:

મજૂરી	24,00
ભાડું	12,000
પગાર	18,000
વીમો	9,000
જાહેરાત	3,600
વર્ષ દરમિયાનના વ્યવહારો:	
રોકડ વેચાણ	90,000
શાખાને મોકલેલ માલ	4,50,000
શાખાએ પરત કરેલ માલ	45,000
દેવાદારોએ શાખાને પરત કરેલ માલ	12,600
દેવાદારો પાસેથી મળેલ રોકડ	3,00,000
અગાઉથી માંડી વાળેલ ઘાલખાધના મળ્યા	3,000
માંડી વાળેલ ઘાલખાધ	900

ફર્નિચર પર 10% લેખે ઘસારો ગણેલ છે.

ઉપરની વિગતો પરથી (1) શાખા ખાતું (2) શાખાનું વેપાર અને નફા-નુકશાન ખાતું (3) પેટા રોકડ ખાતું (4) શાખાના દેવાદારોનું ખાતું તૈયાર કરો.

પ્રશ્ન-2

જૂનાગઢ ઇલેક્ટ્રિક કં.લિ.નું; તા.31-3-2019ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે.

(20)

ઉધાર	રૂ.	જમા	રૂ.
10%ના રોકાણો	50,000	ઇકિવટી શેરમૂડી	1,50,000
જમીન-મકાન	70,000	પ્રેફરન્સ શેરમૂડી	50,000
થંત્રો	90,000	10%ના ડિબેન્ચર્સ	60,000
મેઈન્સ	30,000	શેર પ્રીમિયમ	24,000
ટ્રાન્સફોર્મર્સ	50,000	લેણદારો	10,000
મોટર્સ	15,000	વીજળીનું વેચાણ	90,000
ફર્નિચર	12,000	કન્ટીન્જન્સી અનામત	16,000
દેવાદારો	16,000	મરામત અનામત	5,000
વહીવટી ખર્ચો	25,000	ઘસારા ફંડ	30,000
વીજળી ઉત્પાદન ખર્ચો	25,000	મીટર ભાડું	10,000
વીજળી વિતરણ ખર્ચો	6,000	રોકાણો પર વ્યાજ	5,000
ભાડું-વેરા	5,000	નફા-નુકશાન ખાતું (તા.1-4-2018)	10,000
પરચૂરણ ખર્ચો	4,000		
ડિબેન્ચર વ્યાજ	3,000		
મરામત ખર્ચો	2,000		
વીમા પ્રીમિયમ	4,000		
કાનૂની ખર્ચો	2,000		
હાથ પર માલસામગ્રી	20,000		
હાથ પર રોકડ/બેંક	21,000		
પગાર	10,000		
	4,60,000		4,60,000

વધારાની માહિતી:

- (1) વર્ષ દરમિયાન મૂડી-મિલકતમાં નીચે મુજબ વધારો થયેલ છે.
જમીન-મકાન રૂ.30,000, યંત્રો રૂ.32,000, મેઈન્સ રૂ.10,000, ટ્રાન્સફોર્મર્સ રૂ.15,000 અને ઇક્વિટી શેરમૂડી રૂ.50,000.
- (2) મિલકતોની શરૂઆતની બાકી પર 5% લેખે ઘસારો ગણો.
- (3) દર વર્ષે મરામત અનામત ખાતે રૂ.5,000 તથા કન્ટીન્જન્સી અનામત ખાતે રૂ.4,000 લઈ જાય છે
કંપની એક્ટ, 2013 અનુસાર કોઈપણ છ નોંધ સહિત વાર્ષિક હિસાબો તૈયાર કરો.

અથવા

પ્રશ્ન-2 ટાટા ઇલેક્ટ્રિક કં.લિમિટેડના નીચે આપેલા કાચા સરવૈયા તથા વધારાની માહિતી પરથી તા.31-3-2019ના રોજ પૂરા થતાં (20) વર્ષનું જરૂરી નોંધો સહિત નફા-નુકશાનનું પત્રક તૈયાર કરો.

ઉધાર	રૂ.	જમા	રૂ.
જમીન-મકાન	4,40,000	ઇક્વિટી શેરમૂડી (દરેક રૂ.10)	10,00,000
મેઈન્સ	10,00,000	પ્રેફરન્સ શેરમૂડી	4,00,000
મશીનરી	14,00,000	10%ની ગુજરાત સ્ટેટ લોન	5,00,000
ફર્નિચર	1,20,000	મીટર ભાડું	60,000
દેવાદારો	1,00,000	વીજળીનું વેચાણ (કુલ)	6,00,000
હાથ પર સ્ટોક	1,00,000	ઘસારા ભંડોળ (1-4-2018)	2,20,000
રોકડ બેંક બાકી	1,51,000	કન્ટીન્જન્સી અનામત	2,00,000
ગુજરાત સ્ટેટનું વ્યાજ	20,000	નફા-નુકશાન ખાતું	6,00,000
GUVML પાસેથી પાવર ખરીદી	60,000	વીજ સબસીડી (GUVML પાસેથી)	20,000
રાજ્ય વીજ ભારણ કેન્દ્રના ખર્ચા	20,000		
માનવ સંસાધન પગાર-ભથ્થાં	1,00,000		
કન્ઝ્યુમર બિલ્ડિંગ સેન્ટરના ખર્ચા	20,000		
ભાડું વેરા	29,000		
કેબલ્સ નેટવર્ક	40,000		
	36,00,000		36,00,000

- (1) વર્ષ દરમિયાન વધારો: જમીન-મકાન રૂ.1,40,000, મેઈન્સ રૂ.2,00,000, મશીનરી રૂ.2,00,000, ફર્નિચર રૂ.20,000, ઇક્વિટી શેરમૂડી રૂ.1,00,000.
- (2) શરૂઆતની બાકી પર ઘસારો ગણો: જમીન-મકાન 2%, મેઈન્સ 5%, મશીનરી તથા ફર્નિચર 10%.
- (3) કન્ટીન્જન્સી અના. ખાતે રૂ.1,00,000 લઈ જાવ.

પ્રશ્ન-3 X કંપની લિ.નું તા.31-3-2019ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. (15)

જવાબદારીઓ	રૂ.	મિલકતો	રૂ.
શેર થાપણ:		જમીન-મકાન	4,00,000
80,000 ઇક્વિટી શેર દરેક રૂ.10નો એક એવા,		પ્લાન્ટ મશીનરી	2,00,000
શેરદીઠ રૂ.8 ભરપાઈ	6,40,000	સ્ટોક	40,000
નફા-નુકશાન ખાતું	1,00,000	પરચૂરણ દેવાદારો	1,60,000
સામાન્ય અનામત ખાતું	2,60,000	બેંક સિલક	4,00,000
10%ના ડિબેંચર	1,00,000		
પરચૂરણ લેણદારો	1,00,000		
	12,00,000		12,00,000

વાર્ષિક સભામાં નીચે મુજબ ઠરાવ થયો.

- (1) ભરપાઈ ઇક્વિટી શેરમૂડી પર 10% ડિવિડન્ડ રોકડમાં આપવું.

(2) અપૂર્ણ ભરપાઈ થયેલ શેરને બોનસ દ્વારા પૂર્ણ ભરપાઈ કરવો અને ત્યારબાદ દરેક 8 શેરદીઠ 1 બોનસ શેર પૂર્ણ ભરપાઈ ગણી આપવો.

(3) ડિવિડેન્ડ 4%ના પ્રીમિયમ પરત કરવા.

ઉપરની વિગત પરથી કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો અને ઉપરની બાબતોની અસર આપ્યા બાદનું પાકું સરવૈયું બનાવો.
અથવા

પ્રશ્ન-3(અ) ધરમ લિમિટેડે પોતાના દરેક રૂ.10નો તેવા 3,00,000 ઇક્વિટી શેરો જે પૂરેપૂરા ભરપાઈ થયેલા છે, તે શેરદીઠ રૂ.12ના ભાવે (10)
પરત ખરીદી લેવાનો ઠરાવ પસાર કર્યો. પરત ખરીદી (બાયબેક)ના હેતુ માટે 10%ના રિડિમેબલ પ્રેફરન્સ શેર 15000 દરેક રૂ.100નો તેવા બહાર પાડ્યા. જે પૂરેપૂરા ભરપાઈ થયા.
તે દિવસે કંપનીના જમીનગીરી પ્રીમિયમ ખાતાની બાકી રૂ.1,80,000 છે અને સામાન્ય અનામત ખાતે 30,00,000ની બાકી છે.
બેંક સિલક રૂ.22,50,000 છે.

બાયબેક અંગે જરૂરી જોગવાઈઓનું પાલન કરી કંપનીએ ઇક્વિટી શેરહોલ્ડરોને નાણાં ચૂકવી આપ્યા.

બાયબેકને લગતા ઉપરના વ્યવહારોની આમનોંધ લખો.

(બ) નીચેના વ્યવહારોની આમનોંધ આપો. (05)

1. એક કંપનીની ભરપાઈ થયેલી મૂડી રૂ.100નો એક એવા 75,000 ઇક્વિટી શેરની બનેલી છે. કંપનીએ ઠરાવ પસાર કરીને દરેક ઇક્વિટી શેરનું રૂ.10નો એક એવા 6 ઇક્વિટી શેર તથા રૂ.5નો એક એવા 8 ક્યુ. પ્રેફ. શેરમાં વિભાગીકરણ કર્યું.

2. યશ લિમિટેડે તેના રૂ.100નો એક એવા 30 ઇક્વિટી શેરનું રૂ.3,200ના ઇક્વિટી સ્ટોકમાં રૂપાંતર કર્યું.

3. એક કંપની રૂ.10નો તેવા 1,00,000 ઇક્વિટી શેરનું રૂ.100નો તેવા 10,000 ઇક્વિટી શેરમાં એકીકરણ કર્યું.

પ્રશ્ન-4(અ) પરીન કં.લિ.ના હિસાબી વર્ષો 2017-18 અને 2018-19ની માહિતી નીચે મુજબ છે. તેના ઇક્વિટી શેર અને નફાની માહિતી (08)
નીચે મુજબ છે. શેરની વાજબી કિંમત રૂ.50 હતી.

વિગત	2017-18	2018-19
ભરપાઈ ઇ.શેરમૂડી દરેક રૂ.10નાં શેરમાં (1 લી એપ્રિલ) (રૂ.)	8,00,000	8,00,000
શેરહોલ્ડરોને ફાળવી શકાય તેવો ચોખ્ખો નફો (રૂ.)	4,00,000	6,00,000
આપવામાં આવેલ હકકના શેર શેરદીઠ રૂ.30ના ભાવે (તા.5-4-18)	--	20,000

ઉપરની માહિતી પરથી બન્ને વર્ષ માટે EPSની ગણતરી કરો અને શેરદીઠ નવી વાજબી કિંમત શોધો.

(બ) ગોપી કંપની લિ.ની નીચેની માહિતી મળે છે. (07)

(1) તા.31-3-2018ના રોજ પૂરા થતા વર્ષનો ઇક્વિ.શેરનાં ફાળે આવતો નફો રૂ.3,20,000

(2) તા.31-3-2018ના રોજ પૂરા થતા વર્ષની ઇક્વિ.શેરની બાકી સંખ્યા

(દરેક રૂ.10નો પૂર્ણ ભરપાઈ) રૂ.80,000

(3) તા.31-3-2019ના રોજ પૂરા થતા વર્ષનો ઇક્વિ. શેરનાં ફાળે આવતો નફો રૂ.2,40,000

(4) તા.1-12-2018ના રોજ દર બે શેર દીઠ એક શેર બોનસ તરીકે કરેલ છે.

AS-20 મુજબ EPS ગણો.

અથવા

પ્રશ્ન-4(અ) નીલેશ લિ.ની નીચેની માહિતી મળે છે. (10)

(1) હિસાબી વર્ષ 1-4-2018થી 31-3-2019.

(2) ઇક્વિટી શેરની ભારિત સંખ્યા 10,00,000.

(3) વર્ષ 2018-19નો ચોખ્ખો નફો રૂ.18,00,000.

(4) વર્ષ 2018-19 દરમિયાન શેરની સરેરાશ વાજબી કિંમત-શેરદીઠ રૂ.40.

(5) વર્ષ 2018-19 દરમિયાન શેર વોરન્ટ કે જે 2,00,000 ઇક્વિટી શેર શેરદીઠ રૂ.25ની કિંમતે મેળવવાનો હકક ધરાવે છે.

ઉપરની માહિતી પરથી શેરદીઠ મૂળભૂત કમાણી અને શેરદીઠ અવમિશ્રિત કમાણી શોધો.

(બ) વિનય લિ.નું મૂડીમાળખું તા.31-3-2019ના રોજ નીચેની વિગતો જાહેર કરે છે. (05)

(1) ઇક્વિટી શેરમૂડી 1,40,000 શેર દરેક રૂ.10નો

- (2) 10%ના નોન ક્યુ.પ્રેફ.શેર 40,000 દરેક રૂ.10નો
- (3) 10%ના ક્યુ.પ્રેફ.શેર 40,000 દરેક રૂ.10નો
- (4) પ્રેક્ટિસ શેરમૂડીને ડિવિડન્ડ ચૂકવ્યા પહેલાનો નફો રૂ.3,00,000નો સંચાલકોએ નોન ક્યુ.પ્રેફ. શેર પર 8% લેખે ડિવિડન્ડ આપવા ઠરાવ્યું છે.
- EPSની ગણતરી માટે અંશની રકમ (ઇકિવટી શેરહોલ્ડર્સનો નફો) શોધો.

ENGLISH VERSION

- Que-1 Arun Trading has a Branch at Bhavnagar. Goods are supplied by Head Office to branch at cost plus 25%. All the Branch expenses are paid by Head office, except petty expenses, which are to be paid out of petty cash balance of Rs.400 kept on Imprest system. (20)

	Rs.
Stock on 1-1-2019	10,000
Debtors on 1-1-2019	6,000
Petty Cash on 1-1-2019	400
Furniture on 1-1-2019	12,000
Goods invoice to Branch	40,000
Returns from Debtors	2,000
Discount allowance to customers	200
Bad debts written off	100
Cash sales	6,000
Credit sales	30,000
Expenses of Branch:	
Salary	2,400
Rent (for 9 months)	1,800
Furniture (1-10-19)	350
Cash paid to Head Office	6,000
Stock on 31-12-2019	32,000
Cash collected from Debtors	6,000
	32,000

Write off 10% depreciation of Furniture

Prepare the Bhavnagar Branch Account, Branch Trading and Branch Profit and Loss Account in the Books of Head Office for the year ended 31st December, 2019.

OR

- Que-1 Dev Traders of Surat has a branch at Junagadh. The head office sent at cost price to the branch. Branch sells the goods on cash as well as credit and sends all the cash to H.O. by bank draft on the same day. H. O. pays all the expenses of branch and sends petty cash for the miscellaneous expenses of Rs.600 at the beginning of every month. From the books of H.O. Following Details are available in respect of the Junagadh Branch for the year ending 31st March, 2019.

Particulars	Debit balance Rs.	Credit balance Rs.
Stock	30,000	1,20,000
Debtors	1,80,000	2,40,000
Petty Cash	1,800	3,000
Furniture	?	81,000
Prepaid insurance	1,200	900
Unpaid salary	2,100	1,800

Cash sent to branch for expenses:

Labour	24,00
--------	-------

Rent	12,000
Salary	18,000
Insurance	9,000
Advertisement	3,600
Transactions during the year:	
Cash sales	90,000
Goods sent to branch	4,50,000
Goods returned by branch	45,000
Good returned by debtors	12,600
Cash received from debtors	3,00,000
Bad debts recovered	3,000
Bad debts	900

10% Depreciation is charged on furniture

Prepare in the books of H.O.:

(1) Branch A/c. (2) Branch's Trading A/c. and P & L A/c. (3) Petty Cash A/c.

(4) Debtors A/c.

Que-2

The Trial Balance of Junagadh Electricity Co. Ltd. as on 31-3-2019 is as under:

(20)

Debit	Amt Rs.	Credit	Amt. Rs.
10% investment	50,000	Equity Capital	1,50,000
Land and Building	70,000	Pref. Share Capital	50,000
Plant	90,000	10% Debenture	60,000
Mains	30,000	Security Premium	24,000
Transformers	50,000	Creditors	10,000
Motors	15,000	Sale of Electricity	90,000
Furniture	12,000	Contingency Reserve	16,000
Debtors	16,000	Reserve for Repair and maintenance	5,000
Adm. Expenses	25,000	Depreciation Fund	30,000
Electricity Generation Charges	25,000	Meter Rent	10,000
Electricity Distribution Charges	6,000	Int. on investment	5,000
Rent and Tax	5,000	Profit and Loss A/c (1-4-18)	10,000
Sundry expenses	4,000		
Debenture Interest	3,000		
Repairs	2,000		
Insurance Premium	4,000		
Legal Expenses	2,000		
Material on hand	20,000		
Cash on hand	21,000		
Salary	10,000		
	4,60,000		4,60,000

Additional Information:

(1) Following increase took place in capital assets during the year.

Land and Building Rs.30,000, Plant Rs.32,000, Meins Rs.10,000, Transformers Rs.15,000 and Equity Share Capital Rs.50,000.

(2) Calculate depreciation at 5% on opening balance of assets.

(3) Provide Rs.5,000 for Reserve for Repair and Maintenance and Rs.4,000 for Contingency Reserve.

Prepare final accounts with any Six Notes as per Provision of Companies Act, 2013.

OR

Que-2

Prepare Profit and Loss Statement With necessary Notes as per Provisions of Indian Companies Act, 2013 of the Tata Electricity Ltd. for the year ended on 31-3-2019 from the

(20)

following Information.

Particulars	Debit Rs.	Particulars	Credit Rs.
Land and Building	4,40,000	Equity share Capital (each of Rs.10)	10,00,000
Mains	10,00,000	Pref. share capital	4,00,000
Machinery	14,00,000	10% Gujarat State Loan	5,00,000
Furniture	1,20,000	Rent of Meter	60,000
Debtors	1,00,000	Sales by electricity (Total)	6,00,000
Stock on hand	1,00,000	Depreciation Fund(1-4-18)	2,20,000
Cash and Bank	1,51,000	Contingency reserve	2,00,000
Int. on Guj. State Loan	20,000	P. & L. account	6,00,000
Power Purchase from GUVNL	60,000	Subsidy from GUVNL	20,000
Exp. of State power loan Centre	20,000		
Salary/Allowances of HRD	1,00,000		
Exp. of Consumer Building Centre	20,000		
Rent Tax	29,000		
Cable Network	40,000		
	36,00,000		36,00,000

(1) Increase during the year:

Land & Building Rs.1,40,000, Mains Rs.2,00,000, Machinery Rs.2,00,000,
Furniture Rs.20,000, Equity share capital Rs.1,00,000

(2) Provide Depreciation on opening balance of tangible assets Land & Building 2%,
Mains 5%, Machinery and Furniture 10%.

(3) Transfer Rs.1,00,000 to contingency fund.

Que-3

Balance sheet of the X Co. Ltd. ass on 31-3-2019 is as under.

(15)

Liabilities	Rs.	Assets	Rs.
Share Capital: 80,000 equity share each of Rs.10		Land and building	4,00,000
Rs.8 per share is paid up	6,40,000	Plant and Machinery	2,00,000
P & L A/c.	1,00,000	Stock	40,000
General Reserve A/c.	2,60,000	Debtors	1,60,000
10% Debenture	1,00,000	Bank balance	4,00,000
Creditors	1,00,000		
	12,00,000		12,00,000

Following resolutions are passed in the AGM.

(1) To Pay 10% dividend on paid up equity share capital in cash.

(2) Partly paid up shares are made fully paid up by bonus and after that one fully paid
up bonus share is given for every eight shares held.

(3) Debenture are redeemed at 4% premium.

Pass necessary entries in the books of the company and prepare balance sheet after
giving the effect of above adjustments.

OR

Que-3(A)

Dharam Ltd. Passed a resolution to buy back its own 3,00,000 shares of face value of Rs.10
each fully Paid at the price of Rs.12. The company issued 15,000 10% Redeemable
preference share each of Rs.100 which were fully subscribed and paid up.

(10)

At that time the company had a balance of Rs.1,80,000 in Security premium Account and
Rs.30,00,000 in General Reserve Account Bank balance was Rs.22,50,000. The company
paid off the amount to equity holders after complying with the provisions in respect of buy-
back.

Make journal entries of above transaction in the books of the company.

(B) Pass the journal entries for following transactions.

(05)

- (1) A company's subscribed capital is made of 75,000 equity shares of Rs.100 each. It is resolved that every share of Rs.100 each is converted in to 6 equity shares of Rs.10 each and 8 cumulative preference share of Rs.5 each.
- (2) Yash Ltd. has converted 30 equity shares of Rs.100 each into equity stock of Rs.3,200.
- (3) A company converts 1,00,000 equity shares of Rs.10 each into 10,000 equity shares of Rs.100 each.

Que-4(A) Information of Parin Co. Ltd. for the accounting year 2017-18 and 2018-19 regarding its equity share and profit is as under. (08)

Particulars	2017-18	2018-19
Subscribed and fully paid Equity share capital on 1 st April		
Face value of Equity share Rs.10 Rs.	8,00,000	8,00,000
Net profit attributable to shareholder Rs.	4,00,000	6,00,000
Right issue at Rs.30 per share on 5-4-2018	--	20,000

Fair value of share during the year was Rs.50. Calculate EPS for both the years and find out new fair value of share.

(B) Following particulars are available from books of Gopi Co. Ltd. (07)

- (1) Profit for equity shareholders for the year ending on 31-3-2018 Rs.3,20,000.
 - (2) Balance of equity shares (each of Rs.10 fully paid) on 31-3-2018 Rs.80,000 shares
 - (3) Profit for equity shareholders for the year ending on 31-3-2019 Rs.2,40,000
 - (4) On 1-12-2018, Co. has given one bonus share against two equity shares.
- Calculate EPS as per AS-20.

OR

Que-4(A) Nilesh Ltd. provide following information: (10)

- (1) Accounting year 1-4-2018 to 31-3-2019
- (2) Weighted average no. of equity shares 10,00,000.
- (3) Net profit for the year 2018-19 is Rs.18,00,000.
- (4) Fair value of equity share during the year Rs.40.
- (5) During 2018-19, share warrants having right to receive 2,00,000 equity shares at Rs.25 per share.

From the above particulars find out Basic EPS and diluted EPS.

(B) Vinay Ltd. Provides following details of its capital structure for the year ending on 31-3-2019. (05)

- (1) Equity share 1,40,000 each of Rs.10.
 - (2) 10% non Cumulative Pref. share 40,000 each of Rs.10.
 - (3) 10% Cumulative Pref. share 40,000 each of Rs.10.
 - (4) Profit before payment of Pref. Dividend is Rs.3,00,000. Board of directors has recommended 8% dividend for non cumulative Pref. share.
- Find out profit available for Equity shareholders.
